

બ્રેમ્પટન કાઉન્સિલનો ઠરાવ અને ચિલ્નો વિષયક ઉપનિયમ અપડેટ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (28 જાન્યુઆરી 2020) – જાન્યુઆરીની 22મીએ થયેલ સભામાં બ્રેમ્પટન સીટી કાઉન્સિલે સિટીની ચિલ્નો વિષયક ઉપનિયમ (Sign By-law) સમીક્ષા ન થાય ત્યાં સુધી એવા કોઈપણ ચિલ્નો પોસ્ટ કરવાનો પ્રતિબંધ ફરમાવ્યો છે જેમાં સોશ્યલ મિડિયા કે ઉમેદવાર વિષયક કોઈપણ સંદર્ભ સમાવેલ હોય અથવા તો તેમની ઓળખ દર્શાવતો હોય.

ઠરાવ ફરમાવે છે કે:

વાણી-સ્વાતંત્ર્ય સાથે બ્રેમ્પટનમાં ચિલ્નોના પાટિયા સાથેના દ્રશ્યમાન લેન્ડસ્કેપમાં સમતુલા જાળવવાના હિતમાં એવા ચિલ્નો જે ચુંટાયેલ અધિકારી કે ઉમેદવાર (જેનો સંદર્ભ કાઉન્સિલ, પ્રોવિશ્યલ કે ફેડરલ ઓફિસના સદસ્ય સાથે છે, અથવા તો ફોટા, વેબસાઈટ અથવા તો સોશ્યલ મિડિયાની લિંકનો સમાવેશ થતો હોય)ની ઓળખ આપતા ચિલ્નોનો ઉપયોગ કરવાની મંજૂરી તે સમય સુધી નથી જ્યાં સુધી સાઈન બાય-લો 399-2002 ની સમીક્ષાનું સમાપન અથવા સુધારો કાઉન્સિલ દ્વારા ધ્યાન પર લેવામાં ન આવે.

આ ઠરાવ, જાન્યુઆરી 9મીના સિટી રજીસ્ટ્રેશન અનુસાર જ્યારે સિટી સાઈન બાય-લોની વ્યાપક સમીક્ષા હાથ પર લેશે તે સમય દરમિયાન "સ્લો ડાઉન (ધીમા પડો)"નાં ચિલ્નો પોસ્ટ કરવાની મંજૂરી ચાલુ રહેતી હોવાનું ફરમાવે છે. જોકે, એવા કોઈપણ "સ્લો ડાઉન" કે અન્ય ચિલ્નો જે 22 જાન્યુઆરી 2020ના દિન પછી ઊભા કરવામાં આવ્યા હોય તે કાઉન્સિલના ઠરાવ અનુરૂપ હોવા જોઈશે, જેમાં તે માંગનો સમાવેશ થશે કે એવી કોઈપણ સંદર્ભિત વેબસાઈટ ચુંટાયેલ અધિકારીની ઓળખ આપશે નહીં. આ ઠરાવ "કૃપા કરી ધીમા પડો (please slow down)" ચિલ્નો પોસ્ટ કરવાની મંજૂરી ચાલુ રાખે છે જેની પરવાનગી સાઈન બાય-લોની કલમ 8(4) હેઠળ આપવામાં આવેલ છે. તે છૂટની મંજૂરી 2002માં આપવામાં આવી હતી. સિટી, જાન્યુઆરી 9 ના સિટી નિવેદન મુજબ સાઈન બાય-લોની વિસ્તૃત સમીક્ષા કરવાનું ચાલુ રાખશે.

આવા ચિલ્નોએ સાઈન બાય-લોની અન્ય તમામ આવશ્યકતાઓનું અનુપાલન કરવાનું પણ ચાલુ રાખવાનું રહેશે જેમાં તે માંગનો સમાવેશ થાય છે કે ચિલ્નો ખાનગી મિલકત પર ઊભા કરવામાં આવે (અને રાઈટ-ઓફ-વે માર્ગો પર નહીં), તેનું કદ 4.3 ચો.ફુટની મર્યાદા ધરાવે, અને તે દ્રશ્યમાન ટ્રિકોણની અંદર ઊભા કરવામાં આવે નહીં. નિવાસીઓએ પોતાની મિલકતના સર્વે ચકાસી લેવાના રહેશે જેથી પોતાની મિલકતની સીમાઓની પુષ્ટિ મળી રહે. ચિલ્નોને લગતા અન્ય સામાન્ય નિયમો અને પ્રતિબંધો સાઈન બાય-લોની કલમ 5 માં મળી શકશે. સિટી પ્રોપર્ટી પર જાહેરાત, જેમ કે બસ આશ્રયસ્થાનો સહિત શહેરની માલિકીનાં અર્બન ફર્નિચર, સિટી પ્રોપર્ટી પરની જાહેરાત સાથે સંબંધિત કાઉન્સિલ દ્વારા માન્ય નીતિ દ્વારા સંચાલિત થાય છે અને સાઈન બાય-લોને આધિન નથી. સિટી અપેક્ષા રાખે છે કે તેની વ્યાપક સાઈન બાય-લોની સમીક્ષાનું પરિણામ આ વર્ષના ઉત્તરાર્ધમાં સિટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે.

मिडिया संपर्क :

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अँड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडाल्मक संवाद

सीटी ओफ् ब्रॅम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca